



શ્રી વડાલી કેળવણી મંડળ સંચાલિત

શેઠશ્રી ભુરાલાલ છગનલાલ શાહ આર્ટ્સ
કોલેજ, વડાલી



PROSPECTUS -2021-22

કોલેજમાં ઉપલબ્ધ સુવિધાઓ.

૧. ૧૦ વર્ગખંડ
૨. સ્ટાફરૂમ

૩. કમ્પ્યુટરાઈઝ કાર્યાલય
૪. ગ્રંથાલય અને વાંચનાલય
૫. લેડીઝરૂમ
૬. N.S.S રૂમ
૭. N.C.C રૂમ
૮. SPORTS રૂમ
૯. કમ્પ્યુટર રૂમ
૧૦. ઓડીટોરીયમ
૧૧. રમતગમતનું વિશાળ મેદાન

અભ્યાસના વિષયો

વિનયન વિદ્યાશાળા

B.A.

❖ સેમ-૧ અને ૨ : કુલ પેપર- ૦૮

- ફાઉન્ડેશન કમ્પલસરી-FC અંગ્રેજી- પેપર-૧ ૫૦ માર્ક્સ
- ફાઉન્ડેશન ઇલેક્ટીવ – EC સંસ્કૃત-પેપર-૧ ૫૦ માર્ક્સ
- કોર કમ્પલસરી CC-પેપર-૨ ૨૦૦ માર્ક્સ
- કોર ઇલેક્ટીવ CE- પેપર-૨ ૨૦૦ માર્ક્સ
- ઇલેક્ટીવ ઓપન-EO-પેપર-૧ ૫૦ માર્ક્સ
- ઇલેક્ટીવ જનરીક EG-પેપર-૧ ૫૦ માર્ક્સ

❖ સેમ-૦૩ અને સેમ-૦૪ કુલ પેપર-૭

- ફાઉન્ડેશન કમ્પલસરી FC અંગ્રેજી-પેપર-૧ ૫૦ માર્ક્સ
- કોર કમ્પલસરી CC-મુખ્ય પેપર-૩ ૩૦૦ માર્ક્સ
- કોર ઇલેક્ટીવ CE- ગૌણ પેપર-૨ ૨૦૦ માર્ક્સ

❖ સેમ-૦૫ અને સેમ-૦૬ કુલ પેપર-૦૭

- ફાઉન્ડેશન કમ્પલસરી- FC – અંગ્રેજી પેપર-૧ ૫૦ માર્ક્સ
- કોર કમ્પલસરી CC- પેપર- ૫ ૫૦૦ માર્ક્સ
- ઇલેક્ટીવ જનરિક EG- પેપર- ૧ ૫૦ માર્ક્સ

❖ નીચેના કોર કમ્પલસરી (મુખ્ય) અને કોર ઇલેક્ટીવ (પ્રથમ ગૌણ) વિષય સમૂહોમાંથી પસંદગીનો કોઈપણ એક વિષય સમૂહ પસંદ કરી શકાશે.

કોરકમ્પલસરી (મુખ્ય)	કોર ઇલેક્ટીવ (પ્રથમ ગૌણ)
ગુજરાતી	સમાજશાસ્ત્ર અથવા ઇતિહાસ અથવા સંસ્કૃત
ઇતિહાસ	ગુજરાતી અથવા ડીફેન્સ સ્ટડીઝ
સંસ્કૃત	ગુજરાતી અથવા ડીફેન્સ સ્ટડીઝ
સમાજશાસ્ત્ર	ગુજરાતી અથવા ડીફેન્સ સ્ટડીઝ
અંગ્રેજી	સમાજશાસ્ત્ર

ઇલેક્ટીવ ઓપન ફક્ત સેમ-૧ અને સેમ-૨ માટે નીચેનામાંથી કોરકમ્પલસરી અને કોર ઇલેક્ટીવ સિવાયનો એક વિષય ઇલેક્ટીવ ઓપન તરીકે પસંદ કરવાનો રહેશે.

“સંસ્કૃત અથવા ગુજરાતી અથવા ઇતિહાસ અથવા સમાજશાસ્ત્ર”

❖ વિવિધ અભ્યાસક્રમ માટે વર્ગવાર ફીના દર.

B.A. વર્ષ – ૨૦૨૧-૨૨

સેમેસ્ટર	સેમેસ્ટર- ૧	સેમેસ્ટર- ૨	સેમેસ્ટર- ૩	સેમેસ્ટર- ૪	સેમેસ્ટર- ૫	સેમેસ્ટર- ૬
ભાઈઓ	૧૭૦૦	૧૩૬૦	૧૩૬૦	૧૩૬૦	૧૪૧૦	૧૬૧૦
બહેનો	૧૧૦૦	૭૬૦	૭૬૦	૭૬૦	૮૧૦	૧૦૧૦

- ડીફેન્સ સ્ટડીઝ વિષયની પ્રેક્ટીકલ ફી સેમેસ્ટર-૨ માટે ૧૨૫ રૂ. અલગથી આપવાની રહેશે.
- SC/ST/OBC અને વિકલાંગ વિદ્યાર્થીઓને સરકારના નીતિનિયમો મુજબ સ્કોલરશીપના લાભ મળશે.
- કોલેજમાં પ્રવેશ મેળવેલ દરેક વિદ્યાર્થીને ગુજરાત સરકારની શહીદવીર કિનારીવાલા વીમા યોજના અંતર્ગત રૂ. એક લાખ આકસ્મિક વીમા કવચનો લાભ મળવા પાત્ર છે.
- સરકાર શ્રી અને યુનિવર્સિટી ના નીતિનિયમો મુજબ ફીના દર ફેરફારને આધીન રહેશે.

❖ કોલેજના કેમ્પસમાં શિસ્ત અંગેની સૂચનાઓ.

- કોલેજના દરેક વિદ્યાર્થી પાસે તેનું ઓળખપત્ર હોવું જરૂરી છે.
- વિદ્યાર્થીએ સમયપત્રક મુજબના વર્ગ – વ્યાખ્યાનમાં હાજરી આપવી અનિવાર્ય છે. વ્યાખ્યાન છોડી કેમ્પસમાં ફરવું કે બેસવું નહિ.
- તાસ ના હોય તે સમયે વિદ્યાર્થીઓએ કોલેજ લાઈબ્રેરી કે વાંચનાલયનો ઉપયોગ કરવો.
- વર્ગો ચાલુ હોય ત્યારે કોઈપણ વિદ્યાર્થીએ વર્ગખંડ આગળ અવરજવર કરાવી નહિ.
- કોલેજ કેમ્પસમાં સિગારેટ, પાન મસાલા, ગુટખા વગેરે રાખવા તેમજ સેવન માટે પ્રતિબંધ છે.
- કોલેજની માલમિલકતને નુકશાન થાય તેવી પ્રવૃત્તિ કરાવી નહિ.
- કોલેજ કેમ્પસ કે તેની આસપાસના વિસ્તારમાં વિદ્યાર્થીઓ દ્વારા મારામારી, પજવણી, રેગીંગ કે અન્ય કપીપણ પ્રકારનું ગેરવર્તન જેવી બાબતો ગંભીર સજાને પાત્ર બનશે.
- કોલેજ ભવનમાં મોબાઇલ વાપરવો નહિ.
- કોલેજમાં વિદ્યાર્થીએ હંમેશા શિસ્તબદ્ધ અને વિનયપૂર્ણ વર્તવાનું રહેશે.
- વિદ્યાર્થીએ આંતરિક પરીક્ષાઓ કોલેજે નિયત કરેલા કાર્યક્રમ પ્રમાણે આપણી રહેશે. આ પરીક્ષાઓ પૈકી કોઈ પરીક્ષા કોઈપણ કારણોસર આપશે નહિ તો તેની જવાબદારી વિદ્યાર્થીની રહેશે.
- કોલેજ દ્વારા યોજનાર સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રવૃત્તિઓ વગેરે માટેના કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓએ પ્રત્યક્ષ ભાગ લેવો અને કોલેજ આ સંદર્ભમાં જે વ્યવસ્થા ગોઠવે તે વિદ્યાર્થીએ માન્ય રાખવી.
- કોલેજ સમય દરમ્યાન વિદ્યાર્થી કોઈ નોકરી કરી શકશે નહિ. અને કોલેજ સમય પછી નોકરી કે કોઈપણ કામગીરી સ્વીકારતા પહેલાં વિદ્યાર્થીએ આચાર્યશ્રીને લેખિત જાણ કરવાની રહેશે.
- ઉપરોક્ત કોઈપણ નિયમનો ભંગ વિદ્યાર્થી વ્યક્તિગત કે સમુહમાં રહી કરશે તો આચાર્યશ્રી ધ્વારા શિક્ષાત્મક પગલાં લેવાશે. જે તેણે માન્ય ગણવાનાં રહેશે.
- ઉપરોક્ત નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. તેનો ભંગ કરનાર વિદ્યાર્થી શિક્ષા અને દંડને પાત્ર બનશે. ગંભીર ગેરવર્તણુકને કારણે વિદ્યાર્થીનો પ્રવેશ પણ રદ કરવામાં આવશે.